

**વડોદરા મહાનગરપાલિકા****ટાઉન ડેવલપમેન્ટ વિભાગ****નમૂનો અન્ય અને એપેન્ડિક્સ 'ઈ'****ફોર્મ નંબર-૫ વિનિયમ ૫, ૧****વિકાસની પરવાનગી/રજા ચિટ્ટી નંબર**વોર્ડ HB-24
૯ ૨૦૨૩ - ૨૦૨૪અરજદારશ્રી શ્રીમતિ નિશાબેન ફિરોઝખાન પટેલ તથા સ્વન્ય.

રહેવાસી

અને ટીકા નંબર

સીટી સર્વે નંબર

ટી. પી. નંબર

૧

એક. પી. નંબર

૭૪, ૭૭

મોજે ગામ

ગીરવા-અંકડીયા-

રે. સ. નંબર

૪૭૫, ૪૭૮.

માં

બી. એ.

ચો. મી. એક. એસ. આઈ

ચો. મી.

ઈમારતી બાંધકામ કરવાની તારીખ ૯-૧-૨૦૨૩ ના રોજ મળેલી ૨૩ નોટિસમાં

જણાવેલ બાંધકામનો પ્રકાર નકશા મુજબ ઉપર જણાવેલી ઈમારતી બાંધકામ/લેઆઉટ અંગે મ્યુ. કો. એક્ટના ચેપ્ટર ૧૨ના

૩૯-૩ મુજબ તથા ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૬૯ની કલમ ૨૯-૧ (૧) ૨૯-૧ (૨),

૨૯-૧ (૩) ૩૪ અને કલમ (૧) બી મુજબ અરજદારનો સીટ નંબર સીટી/રેવેન્યુ

સર્વે નંબર ની મળેલી સનદ જેના માપો ખાતેથી નક્કી કરાવી અને નકશાના માપથી હદો

બતાવ્યા પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટના ૩૯સ તથા બાયલોઝને તથા ગુજરાત નગર આયોજન અને શહેરી વિકાસ

અધિનિયમ ૧૯૭૬ અન્વયે સરકારશ્રીએ મંજૂર કરેલા વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળના જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ

રેગ્યુલેશન-૨૦૦૬ને અનુસરીને તેમના જોખમે અને ખર્ચે તેમની પોતાની માલિકી હદમાં આ સાથે મંજૂર કરેલ નકશામાં લાલ

રંગથી બતાવ્યા મુજબ પ્રપોઝેડ બેઝાઈન્ટ દાદર+ભાઈડ+ન્યા.ફ. (૬૦ ફુગન+દાદર+ભાઈડ)+ફ.ફ. (૬૦ ફુગન+

દાદર+ભાઈડ)+ફ.ફ. (૧૨.૫૫ ફુગન+દાદર+ભાઈડ)+ફ.ફ. (૧૩૫.૨૯ ફુગન+ફોટોન્યા.ફ. (૬૦ ફુગન+

ન્યા.ફ. (૬૦ ફુગન+ભાઈડ) મહાનગર પાલિકાના પાયાનગી - ૧. સી. ડી ૬૩૭.૦૩૦-

આપવામાં આવેલો, લુડા પાયાનગી (અરેસ ઇ. ક્ષેત્ર) આપો, માલિકી, કોંગ્રેસ, બેઝાઈન્ટ,

પાયાનગી તથા આપવામાં આવેલ સ્કેમની સ્કેમ સેક્ટો, પાનગી ઇકો- ૨. ગર્વમેન્ટ સેસ ૯૭૫૪૧૦-

અંગેના તમામ બાબતો અંગેના સ્કેમની સ્કેમ સેક્ટો, પાનગી ઇકો- ૩. ગર્વમેન્ટ સેસ ૭૫૦૭૪૪૦-

જરૂરી માલિકી હદો બાંધકામ કરવાનું રહેશે. ૩. મેયુર વમેલે નકશા- ૩. વૈશાલોપાલ ચાજ ૪૪૩૬૫૬૦-

ગુજબ ડાઈડાઈઝાઈન મથાનગી સ્કેમની સ્કેમ સેક્ટો, પાનગી ઇકો- ૪. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

તથા વાપર ઉપયોગ કરવાનો રહેશે. ૫. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૬. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

કોન્સ્ટ્રક્શન ઓ.આ. સર્વે પહેલાં કાર્યરત કરવાના રહેશે. ૭. પાનગી ઇકો- ૫. વ. ગટર લાગત ૩૬૨૨૭૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૮. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૯. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૧૦. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૧૧. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૧૨. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૧૩. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૧૪. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૧૫. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૧૬. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૧૭. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૧૮. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૧૯. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૨૦. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૨૧. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૨૨. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૨૩. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૨૪. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૨૫. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૨૬. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૨૭. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૨૮. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૨૯. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૩૦. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૩૧. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૩૨. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૩૩. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૩૪. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૩૫. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૩૬. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૩૭. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૩૮. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૩૯. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૪૦. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૪૧. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૪૨. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૪૩. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૪૪. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૪૫. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૪૬. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૪૭. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૪૮. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૪૯. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૫૦. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૫૧. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૫૨. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૫૩. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૫૪. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૫૫. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

સર્વે પહેલાં કાર્યરત કરવાનો રહેશે. ૫૬. ગર્વમેન્ટ સેસ નેગ-૩, ડાઈડાઈઝાઈન તથા ૫૭. ગર્વમેન્ટ સેસ ૪૪૩૬૫૬૦-

શરતો અને નિયંત્રણો :-

૧. મજકુર નંબર બતાવેલી જમીનમાંથી મહાનગરપાલિકાને કાંઈક જમીન લીધી હશે અગર કોઈ ભાગ તે છોડવા હકમ કરેલો હશે અગર સનદ સિવાયનો કોઈ ભાગ મહાનગરપાલિકાને કબજો કર્યો હશે તો તે સિવાયના ભાગ માટે રજા ચિઠ્ઠી સમજવી.
૨. વરસાદનું પાણી છાપરા અગર અગાસીમાંથી નીચે ઉતરવા જમીનથી ૬૦ સેન્ટીમીટરથી વધુ ઊંચા ન હોય તેવા નળ મૂકવા અને વરસાદના પાણી સિવાય બીજુ કોઈ તરેહનું પાણી બહાર નીકળી રસ્તામાં પડે તેવી મોરીઓ કરવી નહિ.
૩. મુખ્ય રસ્તા તથા પોળમાં ૩.૬ મીટરથી નીચેના ભાગમાં બારણાં ઉઘડતા કરવા નહિ. જો ૩.૬ મીટર ઉપર કરવા હશે તો મ્યુનિસિપલ બાયલોઝ મુજબ આસપાસ પૂરતું અંતર હશે તો કરવામાં હરકત નથી. જે બારણાં અગર જારીઓ રસ્તા યા પાસેથી ખુદી જમીન ઉપર મૂકશે ને રસ્તા યા પાસેથી જમીનનો યોગ્ય લાગે તેવો ઉપયોગ કરવાનો મહાનગરપાલિકા પોતાના હક્ક કાયમ રાખે છે. મહાનગરપાલિકા રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું પ્રોજેક્શન ૩.૬ મીટરથી નીચે કરવાનું નથી.
૪. રસ્તા ઉપર ઇમારતી સામાન પ્રથમની રજા મેળવ્યા સિવાય નાંખવો નહિ. રજાથી નાંખેલી પુરણી વગેરે વ્યવસ્થિત જોઈતું કોર્ડન કરી ટ્રાફીકને અડચણ ન થાય તેમ નાંખવી.
૫. વોટર વર્ક્સનું પાણી ચણતરમાં વાપર્યા બદલ જુદી ફી આપવી પડશે અને તે આપવા કબૂલ ન હોય તો અરજી કરી નળ અગાઉથી બંધ કરવો. આ નિયમ મીટરથી પાણી સપ્લાય થતું હશે તે જગ્યા માટે જો અરજદાર અગાઉથી જ વોર્ડ શેરી ખાતે નોંધ કરાવશે તો ચણતર માટે અગાઉથી ડીપોઝીટ ભરવાની જરૂર નથી.
૬. રજા ચિઠ્ઠી મ્યુનિસિપલ બાયલોઝ અને વિનિયમો મુજબ આપવામાં આવી છે અને ખાનગી હક્કોના નુકશાનને અંગે મહાનગર સેવા સદન કો ઇપણ જવાબદારી લેતી નથી તથા જમીનના તથા મકાન ટાઈટલ અને પ્લોટ અથવા મકાનના ક્ષેત્રફળની ફેરફારની જવાબદારી લેતી નથી.
૭. મકાન પૂરું થયે કોર્પોરેશન એક્ટ ૨૬૩ મુજબ તથા 'વુડા' ના વિનિયમો એક્ટ ૬ (૨) (બી) મુજબ અરજી કરવી અને ઇમારત વાપરવાની રજા મેળવ્યા પહેલા ઉપયોગ કરવો નહી.
૮. એક વખત પરવાનગી મળી ગયા પછી પરવાનગીમાં નજીવા ફેરફાર વિનિયમો-બાયલોઝ વિરૂદ્ધમાં નહિ કરવાના હોય તો જે જે ફેરફાર તેમના કરવાના હોય તો તમામ ફેરફારો કરતાં પહેલાં રીવાઈઝડ પ્લાન કરી મહાનગર સેવા સદનમાં મંજૂરી માટે મોકલવો અને તે ફેરફારો મંજૂરી મળતાં પહેલા પણ કોઈપણ કારણ કરી દેવા તે મકાન કરનારને છુટ રહેશે પણ તે ફેરફારો/વિનિયમો વિરૂદ્ધ હશે તો ગમે તેટલા નુકશાન થશે તો પણ કોઈપણ કારણ ધ્યાનમાં લીધા વગર તોડી નાખવામાં આવશે.
૯. ખેતીવાડી જમીનનો ઉપયોગ સિવાયના કામમાં કરવા બાબતમાં બોમ્બે લેન્ડ કોડની કલમ ૬૫ મુજબ જ્યારે રજા આપવામાં આવેલી હોય ત્યારે જે શરતો રાખવામાં આવી હોય તે મુજબ વર્તવાની જરૂરીયાત રજા ચિઠ્ઠીથી રદ થતી નથી વળી રજા માંગવામાં અગર તેની શરતો પાળવામાં કસુર કરશે તો તમે બોમ્બે રેવન્યુ કોડમાં જણાવેલી શિક્ષાને પાત્ર થશો!
૧૦. જે જમીન તદ્દન ખુલ્લી હોય તેની ઉપર મકાન કરવાનું હોય અગર પાયામાંથી નવું મકાન કરવાનું હોય તો સનદ મુજબ પ્લાનમાં સીટી સર્વે અગર રેવન્યુ ખાતે ચેક કરાવી કામ શરૂ કરવું તથા ચેક થયાનો દાખલો અત્રે મોકલી આગળ કામ કરવું.
૧૧. રજા ચિઠ્ઠી મહાનગરપાલિકા ઇન્સ્પેક્ટર અથવા બીજા અધિકારી જોવા માગે તેને બતાવવા માલિક બંધાયેલ છે. તે નહી બતાવશે તો તે કામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે.
૧૨. મકાનની અંદર તેમજ બહાર થવાના તમામ સેનેટરી તથા ડ્રેનેજ કનેક્શન મહાનગર સેવા સદન તરફથી લાયસન્સ ધરાવતા પ્લંબરો મારફતે કરાવવા અને તેમ કરવા કસુર થશે તો તે બદલ કાયદેસર પગલાં લેવામાં આવશે. લાયસન્સ ધરાવતા પ્લંબરોનું લીસ્ટ વોર્ડના ઇજનેર સાહેબની ઓફીસેથી મળી રહેશે.
૧૩. બાંધકામ નીચેની જમીન માટે ૧૮૮૪ના લેન્ડ એક્ટની કલમ ૪ મુજબ એકવાયર કરવાને સંદર્ભે એક્ટની કલમ નોટીફિકેશન નીકળ્યું હશે તો રજા ચિઠ્ઠી એક્ટની કલમ ૨૪(૭) મુજબ મે કલેક્ટર સાહેબની રજા લેવાની મટી જતી નથી.
૧૪. આ પરવાનગી ચિઠ્ઠી પહોંચ્યાની તારીખથી ૧૨ માસ ચાલશે. મુક્ત વિતે કરી રજા લેવી પડશે અથવા તાજી કરવી પડશે.
૧૫. કંપ્લીશન સર્ટીફિકેટ મેળવવા અરજી સાથે ફોર્મ નંબર-૬ મુજબ લાયસન્સ હોલ્ડર અને પ્લંબર સર્ટીફિકેટ રજુ કરવું.
૧૬. સ્થળે જો હાઈટેન્શન કે લો-ટેન્શન ઇલેક્ટ્રીક લાઈન, ટેલીફોન લાઈન, ડ્રેનેજ લાઈન, પાણીની લાઈન તથા ગેસ લાઈન પસાર થતી હશે તો સંબંધિત ખાતાનો સંપર્ક સાધી તે હઠાવ્યા બાદ જ બાંધકામ શરૂ કરવાનું રહેશે. આ અંગેની સઘની જવાબદારી અરજદારની રહેશે.
૧૭. એરોડ્રામ ઓથોરિટીના સર્ટીફિકેટની જરૂર હોય એવા કિસ્સાઓમાં સીવીલ એવીએશન ડીપાર્ટમેન્ટનું પ્રમાણપત્ર મેળવી બાંધકામ કરવાનું રહેશે.
૧૮. દરેક રૂમ અથવા જગાનો ઉપયોગ મંજૂર થયેલા ઉપયોગ મુજબ કરવાનો રહેશે અને તેની જવાબદારી અરજદારની રહેશે.
૧૯. વિકાસ પરવાનગી/રજા ચિઠ્ઠી અને મંજૂર થયેલા નકશાઓ, ડ્રોઈંગ સ્પેસીફિકેશન મેળવેલા હોય તો માલિક આ વિનિયમો બાયલોઝની જરૂરીયાત મુજબ કરવાની જવાબદારીમાંથી ક્ષેપીત રહેવાની શક્યતા નહિ.
૨૦. મંજૂર નકશા વિરૂદ્ધ બાંધકામ કરવાથી/રજા ચિઠ્ઠીમાં જણાવેલ શર્તોનો ભંગ કરવાથી/ઓક્યુપેશન સર્ટીફિકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરવાથી રજા ચિઠ્ઠી આપોઆપ રદ થયેલ ગણવામાં આવશે.
૨૧. નિયમોનુસાર આપેલ પરવાનગી વિરૂદ્ધની બીનઅધિકૃત બાંધકામોને કોઈપણ સંજોગોમાં નિયમબદ્ધ કરવામાં આવશે નહી- બીન અધિકૃત બાંધકામો અન્વયે સબંધ પરવાનગી એન્જીનીયર, આર્કિટેક્ટ, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર વગેરે કોઈપણ જાતની નોટીસ, ચેતવણી આપ્યા વિના તેઓના લાયસન્સ વગેરે રદ કરી 'કાળી યાદી'માં તાત્કાલીક અસરથી મૂકવામાં આવશે.
૨૨. ઓક્યુપેશન-સર્ટીફિકેટ મેળવતાં પહેલા સોસાયટીના આંતરીક રસ્તા પાકા બનાવવાના રહેશે.